રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં ઉષ્માપૂર્ણ હવા- ...આંતરરાષ્ટ્રીય સંબંધો ગણનાપાત્ર

સંપન્ન કલાસ્વામીઓ ખરેખર જુદાં જુદાં રાષ્ટ્રો પ્રેરે છે. આશરે ૨૦ લાખ સોવિયેત લોકોએ ...લય તરફથી યોજાયેલ વિદેશી ચિત્રસંગ્રહોનાં ...ધી હતી. તેના ખંડોમાં ખ્યાતનામ ડ્રેસ્ડન ...અન ફેરાઓહ તુતેનખામેનની કબરોના ખજાના, શાશ્વત રહસ્યમય અને રહસ્યપૂર્ણ શાશ્વત એવી ...ને અમેરિકાના મેટ્રોપોલિટન સંગ્રહાલયનાં ૧૦૦ આવ્યાં છે.

...મહાન કલાકૃતિઓનો પરિચય કરાવવાની, તેમને ...સૌંદર્યને નિરખવામાં અને માણવામાં સહાયભૂત ...જ્ઞાનપ્રેરક કામગીરી સંગ્રહાલયના કર્મચારીઓ લોકોના હિતમાં કલાસ્વામીઓની અમૂલ્ય કલા- ...અને તેની બરાબર દેખભાળ કરે છે.

...ક વ્યાખ્યાન ખંડો છે, મોટી વયના લોકો અને ...યો છે, કલાવિદ્યાપીઠ છે, યુવાન કલાવિદો માટેની ...રોએ જેમ કે, પુનરુત્થાન યુગના મહાન ઇટાલી- ...મેંજેલો વિશે નાટક ભજવ્યું હતું. તેમણે પોતે ...સેટીંગો અને અદાકારો માટેની વેશભૂષા તૈયાર ...ણની સફળતાએ આ સાહસની યથાર્થતા પુરવાર

...ત સંઘનાં ઘણાં સ્થળોએ સંગ્રહાલયની કલાકૃતિઓ ...લયમાં વિશ્વ સંસ્કૃતિના ઇતિહાસ વિશે યોજાતાં વ્યાખ્યાનોનો ... લાભ લે છે.

શાળાનાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે "પ્રાચીન કાળથી સા... યુગ સુધી" એ વિષય પર કાયમી અભ્યાસક્રમ યોજાયેલ છે. લોક... વિશાળ વર્ગ આનો લાભ લે તેવો એનો આશય છે. તે યુવાનોને વિ... કલાના વિકાસના પાયાના તબક્કાઓનો પરિચય કરાવે છે. "કલા... ક્ષેત્રના સમાચારો" વિષય પર હર સપ્તાહે વ્યાખ્યાન યોજવામાં ... છે. સંગ્રહાલયના નિયામક દર્શકો માટે નિયમિતપણે આ કાર્યક્રમ યોજે... કામદારો, ઇજનેરો, શિક્ષકો અને વૈજ્ઞાનિકો આ વ્યાખ્યાનોનો લાભ લે...

સોવિયેત કલા સ્ટુડિયોના આ કેન્દ્રની કામગીરીમાં સો ઉપ... વૈજ્ઞાનિક કાર્યકરો રોકાયેલા છે. ચિત્ર અને શિલ્પ કલાઓના સિદ્ધાં... વિકાસમાં તેમ જ લલિતકલાઓના ઇતિહાસના અભ્યાસમાં તે... પ્રદાન, ખરેખર, ગણનાપાત્ર છે. તેમનું સંશોધનકાર્ય માત્ર સો... સંઘમાં નહીં પરંતુ દેશની બહાર પણ સુપરિચિત છે.

સંગ્રહાલય દેશનું એક અતિ ઉત્તમ કલા પુસ્તકાલય ધરાવ... અને તેના સ્થાપત્યકલા સંગ્રહ અને ચિત્ર સંગ્રહમાં સતત ઉમેરો રહે છે. આ માટેનો ખર્ચ રાજ્ય ભોગવે છે.


સંગ્રહાલયના ખજાનામાં ઘણી વાર સોવિયેત પ્રજા તરફથી સ... લયને ભેટ ધરાતા સંગ્રહોનો ઉમેરો થતો રહે છે.

× × ×

પ્રાચીન રોમની એક ઉક્તિ છે: "કલા અમર છે પરંતુ ઝડપભેર વહી જાય છે." કલા, ખરેખર, અમર છે. અને લલિતકલાઓ અંગેના રાજ્ય પુશ્કિન સંગ્રહાલયના મુલાકાતીને કૃતિઓનો સંપર્ક હંમેશ માટે આશ્ચર્યમાં ડુબાવી દે છે.




સંગ્રહાલયમાં જીર્ણોદ્ધાર કાર્ય કરનાર કલાકારોએ ઘણી જગમશહૂર કૃતિઓમાં નવા પ્રાણ પૂર્યા છે.
તસવીરમાં બાહિલ કૃત 'રેઓમ' (ઇટલી ૧૬મી સદી) ને નવું જીવન અપાવું જ...



This is not text of the book.
This is the ordinary cover of the book, manually made of newspaper material





ન ખંડમાં લઈ જવામાં આવે છે. તે માત્ર મોટાં શહેરોમાં નહીં અહીં

મધ્યયુગીન વસાહતોમાં પણ પ્રદર્શિત કરવામાં આવે છે જ્યાં સંગ્રહાલયના

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

प्रगट प्रछा रे गोर ईमाम नो १

[illegible]

[illegible]

प्रगट प्रछा रे गोर ईमाम नो २

[illegible]

[illegible]

प्रगट प्रछा रे गोर ईमाम नो ३

[illegible]

[illegible]

प्रगट प्रछा रे गोर ईमाम नो ४

[illegible]

[illegible]

[illegible] ५

[illegible]

[illegible]

[illegible] ५

[illegible]

[illegible]

[illegible] ७

[illegible]

[illegible]

[illegible] ८

[illegible]

મધ્યયુગીન વસાહતોમાં પણ

(

[illegible]

वेराट वेर छो रे गो रखी मानो : ९

[illegible]

[illegible]

वेराट वेर छो रे गो रखी मानो : १०

[illegible]

[illegible]

वेराट वेर छो रे गो रखी मानो : ११

[illegible]

[illegible]

वेराट वेर छो रे गो रखी मानो : १२

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

મધ્યયુગીન વસાહતોના ...

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

પ્રગટ પ્રછા રે ગોર રખ નામ ના ૨૩

[illegible]

[illegible]

પ્રગટ પ્રછા રે ગોર રખ નામ ના ૨૪

[illegible]

[illegible]

પ્રગટ પ્રછા રે ગોર રખ નામ ના ૨૫

[illegible]

[illegible]

પ્રગટ પ્રછા રે ગોર રખ નામ ના ૨૬

[illegible]

[illegible]

પ્રગટ પ્રછા રે ગોર રખ નામ ના ૨૭

[illegible]

[illegible]

પ્રગટ પ્રછા રે ગોર રખ નામ ના ૨૮

[illegible]

[illegible]

प्रगट पे छो रे गोर ईमाम नो ः १९

[illegible]

[illegible]

प्रगट पे छो रे गोर ईमाम नो ः २०

[illegible]

[illegible]

प्रगट पे छो रे गोर ईमाम नो ः २१

[illegible]

[illegible]

प्रगट पे छो रे गोर ईमाम नो ः २२

[illegible]

[illegible]

प्रगट पे छो रे गोर ईमाम नो ः २३

[illegible]

[illegible]

आर ॥

अगम अपारे गोरख मा मनो २४

[illegible]

[illegible]

अगम अपारे गोरख मा मनो २५

[illegible]

[illegible]

अगम अपारे गोरख मा मनो २६

[illegible]

[illegible]

अगम अपारे गोरख मा मनो २७

[illegible]

[illegible]

अगम अपारे गोरख मा मनो २८

મધ્યયુગીન

2010 Before -Satpanth Manuscript 21 (171)

[illegible]

[illegible]

प्रगट पढारे गोरख नाम जी २९

[illegible]

[illegible]

प्रगट पढारे गोरख नाम जी ३०

[illegible]

[illegible]

प्रगट पढारे गोरख नाम जी ३१

[illegible]

[illegible]

प्रगट पढारे गोरख नाम जी ३२

[illegible]

[illegible]

प्रगट पढारे गोरख नाम जी ३३

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

अलि कुरने जीतवा थीआ सतगुर आवे ते [illegible]

अगर अढारे गोरख भामनो ३८

त्रेत जुग चार जीती थीआ वाघा सतगुर [illegible]

जीत जुगे थाया [illegible] गरुड ईदा [illegible]

अगर अढारे गोरख भामनो ३९

नारे गोरख [illegible] जीती थीआ सत [illegible]

[illegible]

अगर अढारे गोरख भामनो ४०

अपार [illegible] जर [illegible] तन [illegible]

[illegible] आवे [illegible]

अगर अढारे गोरख भामनो ४१

[illegible]

[illegible]

अगर अढारे गोरख भामनो

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ६

[illegible]

प्रगट प्रकारे गोरख नामनो : ६१

[illegible]

[illegible]

प्रगट प्रकारे गोरख नामनो : ६२

[illegible]

[illegible]

प्रगट प्रकारे गोरख नामनो : ६३

[illegible]

[illegible]

प्रगट प्रकारे गोरख नामनो : ६४

[illegible]

[illegible]

प्रगट प्रकारे गोरख नामनो : ६५

[illegible]

[illegible]

हेजी रे हंसारे गोरखी नाम ना: ४६

[illegible]

[illegible]

हेजी रे हंसारे गोरखी नाम ना: ४७

[illegible]

[illegible]

हेजी रे हंसारे गोरखी नाम ना: ४८

[illegible]

[illegible]

हेजी रे हंसारे गोरखी नाम ना: ४९

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] ५६

[illegible]

[illegible] ५७

[illegible]

[illegible] ५८

[illegible]

[illegible] ५९

[illegible]

[illegible] ६०

[illegible]

[illegible]

प्रेगी प्रेछोरे गोरख मामनो: ११

[illegible]

[illegible]

प्रेगी प्रेछोरे गोरख मामनो: १२

[illegible]

[illegible]

प्रेगी प्रेछोरे गोरख मामनो: १३

[illegible]

[illegible]

प्रेगी प्रेछोरे गोरख मामनो: १४

[illegible]

[illegible]

प्रेगी प्रेछोरे गोरख मामनो: १५

2010 Before -Satpanth Manuscript 21 (171)

[illegible]

[illegible]

अगम अपारे गोरख नाथनो १६

[illegible]

[illegible]

अगम अपारे गोरख नाथनो १७

[illegible]

[illegible]

अगम अपारे गोरख नाथनो १८

[illegible]

[illegible]

अगम अपारे गोरख नाथनो १९

[illegible]

[illegible]

अगम अपारे गोरख नाथनो २०

[illegible] पासारी [illegible] रात्री आधार ॥
नहीं आदी अदशार कारी नीशान सो शमीला ॥
एमरे ओधारे गोरख आमनो ॥ १
दुजे नी धारे हवे हरी मेधारी पीर शाह नो भई ॥
आरे अदशारे नी आदी नहीं दइन [illegible] गोशार ॥
एमरे ओधारे गोरख आमनो ॥ २
एका हे अंतर मांधे रीजे ढा आशा नदाणी ॥
नाम [illegible] आसनु ले धुहरी दहीत नवा नाइ रहे पासे ॥
एमरे ओधारे गोरख आमनो ॥ ३
पांडार हरे शारी दहीं आवी भागे वेदे हे ठदाशा ॥
नाहं पे [illegible] आरा लाहुतु ने दुजि दुलागाम नदारा ॥
एमरे ओधारे गोरख आमनो ॥ ४
एपुलानी आवे आपाया एगा रेपया पीर राणा साह ॥
नी शात पीर गंगा लापायो राजी भाना नी पासे ॥
एमरे ओधारे गोरख आमनो ॥ ५
ईडार नयो सौ दाशे नेहीर पाहरी ते नेवार ॥

२७

ऐसा श्रसइतगोरनीपास्तीमं पाप रयो छे तवे
पइरस.

ऐसा अफारे गोरख मामनो ८६

पन्न पन पडे ठनाथने दन पन गोरखमामनो:

कडुतड़ार गुडामदे दाडुको गंगा ताड़्यालि रानपीलोम्:

ऐसा अफारे गोरख मामनो ८७

ओपातनो अेटलेरहा तापंपा शीनु पदपुडाम को:

गुरूनें परनामें सौजनी रयु सपे सुताछे तवे पडीको:

ऐसा अफारे गोरख मामनो ८८

रागदी इरी

हेदफे गाडु नी याजा शेग ग ना नस्मादेने डु:

परगोहे जो पारजु गोरख मामछे जे इ १

नुगमानी ऐ औ इहे अधर मां ना लोड़ीक :

गोर नर नेदे मानशीदे नु नासि शीध २

राग दपट थी:

नरनी इधा जरपुर शी सुनाहे न थां .. री

श्री लीडी नाम पंत तुझाल माथार मापा नयाडी

[illegible] सा कुरदेवा मगुइा मजन दोन येवो इा:

तेनेकुरवासावा रदे रांमां [illegible] सनी इा:

[illegible] इार [illegible] मइ दाइ [illegible] इदे

[illegible] तीर्थ [illegible] तांइ [illegible] नी [illegible]

[illegible] मगुइा [illegible] नोलावसां:

[illegible]

[illegible] नहीवार [illegible] नगोरे [illegible]

तेना [illegible] नहीवार [illegible]

[illegible] इरी रानेस ना सा सही:

[illegible] पुजे लान [illegible] लो [illegible] २

राग ऊदधा नी

[illegible] गोरख [illegible] वार [illegible]

[illegible] वार [illegible]

ऊगर ऊमीर गोरख जसनी १८

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

...आलशीतमत गा. माए शामपाशीआपार

अपागीरनासजुलमानमापदा: नयाइफानाके अपतार ०॥०

जेणर जेहथारे गीरद मानणो ११३

आणीडफानरशीफ्फैदे: गीरे आप दुआधायपदरन ०॥०

जेमनकीतरेलतासे मनी: दीपाइरीशनदयामन ०॥०

जेणर जेहथारे गीरद मानणो ११४

जेशदेपजेदाथैनतोलोदा: शीदनीमदीशितनेपाशे ०॥०

केतपनआदनारशागाडीफानो: देणीमारेदरीदेतादपा

जेणर जेहथारे गीरद मानणो ११५

ईणजीईदेदीलातना: गीरनीशेपालाइशार ०॥०

दुजांतीतीअफासेनगादीशी पा. शीपादरेपापा

जेणर जेहथारे गीरद मानणो ११६

पदीनारामलदतलना: गीरदेणआपेदुअम ०॥०

तमेरेलसायतीतरकाशीदुडदुलदुरीतेम ०॥०

जेणर जेहथारे गीरद मानणो ११७

[illegible]
[illegible]

एवा एवा रे गोरख आपनो ११८

[illegible]
[illegible]

एवा एवा रे गोरख आपनो ११९

[illegible]
[illegible]

एवा एवा रे गोरख आपनो १२०

[illegible]
[illegible]

एवा एवा रे गोरख आपनो १२१

[illegible]
[illegible]

एवा एवा रे गोरख आपनो १२२

साधी पेर पीर जाद ऐ. शुद्दीर पशापपुं मेंगन जी:
तेरे गान मनु नानतम लेहुं पीर जाद नीर रह पासे जी:
प्रेमा प्रछोरे गोरद आमनो १२३
ऐं अंशु जेप जादया पाय न. दी पहरावाडे होजेया जी:
शीदपीता नानलो दरी. पाले मारे अली पदरेजेया जी:
प्रेमा प्रछोरे गोरद आमनो १२४
ईन मपहु शी पात नु. मनमां जो आशीं पासारी जी:
जेहगाडे री नीजा पीलीडी तारे. ऐ पा गोरर जती प्हारी जी:
प्रेमा प्रछोरे गोरद आमनो १२५
ऐं पुं मपा शी पुप गों: नातनी तगोरनु जोने नापजो:
गोरन रशा मद्र पानने तीं मशोपडुं दोमजी:
प्रेमा प्रछोरे गोरद मापनो १२६
ऐं पाद्धा मतेद्धा पिपछ तों गोर मारे वशीं जो ईशहाप
मडईं डेपापि छ शुंडपुं. दुपा दालेपों डाधा डाम जी:

प्रगट प्रछारे गोरहे भाग नां १२७

अे दश मे गोर हे आपा येः आप ये आ जी ये नां मांहा ॥

अेडा शाहीत येनडे आदायेः जी दना आगीलगार ॥

प्रगट प्रछारे गोरहे भाग नां १२८

डाडा शादेदे दलो गायेः अेडा उतारो नेजोर ॥

अडारा गोर अेठारो नापाशः अेमप्रहीने शामभा अ ॥

प्रगट प्रछारे गोरहे भाग नां १२९

गोरा अेद पुरपुं नहीः गयो शेजन नो मांहीं ॥

गुरु अे प्रछाद आपीयेः दे आडयो ते शीधार ॥

प्रगट प्रछारे गोरहे भाग नां १३०

गोरां तथा भामजा आं: गया पोताने मुकाम ॥

तेणुं ना अपीतां पादर पाशेः ना आपीता गोर मते गम

प्रगट प्रछारे गोरहे भाग नां १३१

रातदें गोरो शुधरहे पोश्रु ताणा देन रहेरे ॥

[illegible]रे तालापा उडाडा आं: उडाडा बांधा पाडा तेहर ॥

ऐसा प्रछार गोरख नाम का १३२

जे दनदस छैताला पा [illegible] पडोप आप पडोप [illegible] पर तका ॥

मान पाद्या छे हाडु नहीं: गोर मूरा पी पुना पाप [illegible] का ॥

ऐसा प्रछार गोरख नाम का १३३

शुध आप शरीर ना: जुं देनारे [illegible] का ॥

आपुं धां न नरे लाले नहीं: लाल लो माने आदारा [illegible] ॥

ऐसा प्रछार गोरख नाम का १३४

अरन [illegible] रत पांचे मन ना: पाछो आपे गोरनाथ [illegible] ॥

पन पो गुने गारे त पत सा: पा [illegible] गुना दे ना [illegible] ॥

ऐसा प्रछार गोरख नाम का १३६

त्रीला दा ना दे [illegible] नहीं: ना [illegible] गाना [illegible] रतार का ॥

पुरा मन मां: [illegible] नहीं [illegible] नहीं [illegible] का ॥

ऐसा प्रछार गोरख नाम का १३७

शतु गारे नेछत्र ब चांजपुः पानताकरेपारमपारज

दाशालापशाणेहपीाकरेस्वाजेकाता रुआहारज :

प्रगट प्रछोरे गोरद नामनां १३७

पाचपाचपरेपानपेहुरकुंगारेदुपेज :

पायेपाछेदाशउिपरेकसतपारेशारारेकेोशेपज

प्रगट प्रछोरे गोरद नामनां १३८

अेपाशततेनेशुणपुपोः अपाप्रपशुणपारारज

पारव्हौतेपाआदपोगोरतपाशप्रछोदेपाइकु शुपलारोज

प्रगट प्रछोरे गोरद नामनां १३९

अेपाप्रछातोअपोरछेःके टला कहुंपाशातरज

अे टलीप्रुधापेहचेनहशः पोडामांकहुस्वासारीज

प्रगट प्रछोरे गोरद नामनां १४०

अेकशापे अेप जपोपाशोः गोरदकुंअेकछुापज

प्रगट प्रछां अेपा पुरापोः शौशु [illegible] पुमनपारज

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

૧૪

એગત એહોતેર ગારદ માગનો ૧૪૬

દુની આજં કોઈ [illegible] નહી તુજ વીનાં તાલીઆ નરાઅણજી

તાર નામનું [illegible] નહી કાર [illegible] આઉં [illegible] પાઅણજી

એગત એહોતેર ગારદ માગનો ૧૪૭

[illegible]

[illegible]

એગત એહોતેર ગારદ માગનો ૧૪૮

[illegible]

[illegible]

એગત એહોતેર ગારદ માગનો ૧૪૯

[illegible]

[illegible]

એગત એહોતેર ગારદ માગનો ૧૫૦

[illegible]

[illegible]

प्रगट प्रछांरे गोरद मानणो १५१

[illegible]

[illegible]

प्रगट प्रछांरे गोरद मानणो १५२

[illegible]

[illegible]

प्रगट प्रछांरे गोरद मानणो १५३

[illegible]

[illegible]

प्रगट प्रछांरे गोरद मानणो १५४

[illegible]

[illegible]

प्रगट प्रछांरे गोरद मानणो १५५

[illegible]

[illegible]

प्रगट प्रछांरे गोरद मानणो १५६

પાતપરજુ જેને પાશા લખી તે પરી પાછે પાશ તારજો:
આદિ કરી શાને અરણે કર હાશાનો ગગશ શીલગારજો

પ્રગટ પ્રછો રે ગોરધ જાગનો ૨૫૭

શંધતપાકર નાને કરી પે જેગ [illegible] રે શાના ૨૫૮ જો
[illegible] હરવો નરપુર પાંડવ જાજ કે એકપીરા તેપ જો:

પ્રગટ પ્રછો રે ગોરધ જાગનો ૨૫૮

[illegible] હાદાન પાર કરપે પાપ છી જાદી એ જે સતે જે જો
સરપ તે પાપારી પુ: જાદી જે ઠ પાનો કરે ઉપાજે જો

પ્રગટ પ્રછો રે ગોરધ જાગનો ૨૫૯

ન જાત સપે ને તે પીઆ આપી જલ્ય સપે તે જે જો:
સપૈ ન પી પાત જાદી ત ની કરે છે પાર પાર જો

પ્રગટ પ્રછો રે ગોરધ જાગનો ૨૬૦

ઠરાપ કર તાં ધં નીર શ્રઃ દીપ રૂ ત ડાધ પાર રી જો:
પાં ડ પાં ડ જાતે જા લીયે જતી જફપી ડી ન પાત જો

પ્રગટ પ્રછો રે ગોરધ જાગનો ૨૬૧

[illegible]

अग्यारे अक्षरे गोरख मायनो १५६

अेरा तेने छ नी कहे - गोरख तेनु रुप तेना मांहे जा:

अेम तं आप ते पोते अेम या; आप थी थी जना मांहे जा:

अग्यार अक्षरे गोरख मायनो: १५७

लखा कर त्रैम मातने: कथावा रक्तो दोधातने जा

धातशु लाशा कारत लाः जुशी पछी छे मात जा:

अग्यार अक्षरे गोरख मायनो: १५८

धात आ मा शौ शा दातने: इला क्षा क्षा सो न तेथी अे जा:

अेनु शुलाने आन द कहे: अेटले पेरा त्यां ने करे ठराय

अग्यारे अक्षरे गोरख मायनो, १५९

सै पैद शौ ने मा जु अे कहा को ला त्या शौ तदेयी अे जा:

अेटले पैरा शान मु जमा लेख लमा धारो इ कहे इ

अग्यार अक्षरे गोरख मायनो १६०

जाउप्रै रा ना अे इ मा लो ता रा ला शा मुं त ला धारे जा:

एसा एजोस्ट इराटुटे गहा आलम ने हराहते राहार जो:

हेगा ते हे छोरे गोरद मामनो १७१

गंगाने सादु टी गहा पंदुआ हेदुनेर रावे मामन जो:

काहे ना पेइट इराटुटी नाहे दाहा दरम शारोज

५ ७

हेगा ते हे छोरे गोरद मामनो १७२

वेदल्पारेदु टी गहे शारदे देहामनाउ हाशा जो

शारदे महामनपाजारद रंगार नेदुरे छपरहा शुज:

हेगाते हे छोरे गोरद मामनो १७३

रागछदवा

हन हान गोरद मामन परन शुधा नेपमाश:

पापा पशार मां पावल नलला पंत मारा:

दलोहाल मां दाम काहे पादु नेपदान:

दयां दराहाल मां पल पलादुशांहान:

शांपादराहाशामदुदवाशा पान वदुश्या

५ वलवामना:

प्रह भान प्रदेपार जु आवे छे प्रगट हाल माहे

राग प्रछामा

[illegible]

[illegible]

प्रगट प्र छोरे गोर हा मा मणो १७४)

[illegible]

[illegible]

प्रगट प्र छोरे गोर हा मा मणो १७५)

[illegible]

[illegible]

प्रगट प्र छोरे गोर हा मा मणो १७६)

[illegible]

[illegible]

हेरी ने छोरे गोर हा मा मणो; १७७

शानु पाशुडगाशांपद्रतडगाडघडगमारेद्राघंश्च रासे क

नासवं माम नुं लंदां मानाःदिः पंडानाहुसंगनो

ऐगा दे ऐ छारे गोरखडे मा मनोः ११७ सें क

न्यनपक्षारेतद्रांपैरवों स्यानांदपदेशांनतदें रसें क

नगारानोअतईडाकागादिः स्यारेतागोरखनारिनरा

ऐगा दे ऐ छारे गोरखडे मा मनो ११८ सें क

शारपमपग गादा रोशोःद्रसवागिरकानोजेशारहेक

नामडोमाननुं लं दुंद्वरसहे मे पाघडे त्याहचा राक

ऐगा दे ऐ छारे गोरखडे मा मनो ११९

घन घन गोरखडे मा मनोः घन घन नमार नेहाशक

इदघडगाछंद नीपांगाशंः ऐगा दे ऐ छानहीं इसें क

ऐगा दे ऐ छारे गोरखडे मा मनो १२०

ऐगादे ऐछारसेमा प्रुसरपाः गगानताशाडारीनाशपुरुसेंक

सदपदपाछरसें गोरतगीरुनमगडानहा क्रोरसें क

[illegible] १८२

[illegible]

[illegible]

[illegible] १८३

[illegible]

[illegible]

[illegible] १८४

[illegible]

[illegible]

[illegible] १८५

[illegible]

[illegible]

[illegible] १८६

[illegible]

[illegible]

[illegible] १८७

[illegible]

[illegible]

[illegible] १८८

[illegible]

[illegible]

[illegible] १८९

[illegible]

[illegible]

[illegible] १९०

[illegible]

[illegible]

[illegible] १९१

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] (२) [illegible]

[illegible] (२) [illegible]

[illegible] (3) [illegible]

[illegible]

[illegible] (४) [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

आंधोध रतन नामु तेजेंग छे
इरमानना जासमला हरहेमान नरहोम:
१=
धिआरात मता धिआ राह्री रंगा २= धिआ राजा जाद्री
३=
रंगी धिआरांहा मानाआ. ४= धिआरंगोरी धिरा
हा. ५= धिआ रटटा साहा उनारट. ६= धिआ
होपा सांह उनाहर. ७= धिआ रोजेरी धिरीहा.
. ८= धिआतुना तोराहा. ९= धिआरशाहरात
मता. १०= धिआसाहा पुतोना. ११= धिआ
साहारा नधुमोइ. १२= धिआराहा रोडुपा. १३
धिआ साहाने हुधा. १४= धिआरतेन. धिआरतेन.
धिआरतेन. १६= धिआरतेन. १७ धिआरतेन०

घरसारतेन ॰१७= घरसारतेन ॰१८= हुकटना के
टनी हा ॰१॰घरसवाहो॰ १॰ माहे महरकुल
टाहे। रतन नामु सपुरणथे ॰॰॰॰ ❀

सारतननामानोजापरसारतले जाती
केडीसे हरीसमन॰ १=हरीसमना घडीरतीहुसे
॰ १ सानेगणु हीज हेतीहीसे॰ ३= तीसे
हीपाहरीने पारसात पुर॰ २=तीनेनी नल
जंघे पावसेराह॰ ॰ पणीडीसे मोटाय
एससराधे थां जुनरंग पीर पेगाजरेराधे॰
थां राहजेराधे॰ थां जुनरंग पीर पेगाजर

2010 Before -Satpanth Manuscript 21 (171)

शरीफ॰ श्री शाह हेज शरीफ दीशाती फरमायाती
हदीस॰ ती जे दीपा ती जी ना फाल करी॰
पोतानी जेमणी जांगुजे जापेतो शाह हेज
सिरद कुम रहे धारे रीख॰ मे हेर पाहणा
ऊपर आपना ने कुलग ना जकरी॰ आन ने ज
ना हई पाजे जानु पला जोड़ा ताला करवो
॰ करीने माहेपा ऊगारे॰ तेने पारसा
तीर जे हांडे लागे नाही॰ पाडुंत श्री अन्हीतश
लोपे नहीं॰ शाह हेज करे तो॰ शाह हजार
जला तेने लोपे नही॰ शाह ते भाण पेगाजर
अँ हांपाहर रोज पर जडे पड़ता॰ तेमने
हांपानी जरूरत छु हालत जुनरंगा पड़ो॰

दणी हररीज दार खेड पडिजे॰ वीसे जं

हाना हरदं पोजार हीसे॰ वी ते शाई

जखा श्रानडर रीही॰ जेडी खेडामशे॰

हेज पाशे माजी॰ तेडाम शाहेज ऊर पा

ऊरीहीं॰ दजीडीजेने नाहुर पेऊ रीसे ना

॰ माहा पीं॰ आजानने ऊ पेहुंचे खे॰

नाहुर डीरी ऊपर॰ खानें खें दीदाइरं॰

न दारशतं॰ ने दा हेत शात लगत पडे॰

तीशा इज खारान डरीशहुं॰ जानुदणा

हीशमन गणु दीज हेता डीखे॰ खाने

खादणा धरं शी नशी डारशे॰ वीतेना

नामनी न दहुं तेडरी॰ डगजऊपर

उतपुजरीजे॰ आने अेदाधा दरोजे दार
दयत तेधादन अेदपादरत गायजरजे॰
आने उत जाउं पर दुइ नाजा जे॰ तो दुइर
मन रीधार धाजे॰ दुशमन दइ धाजे
पजे आने मइ जा लेजे॰ दारीमन
गजे जदराजे॰ तो मागज नु पुतपुपाजुर
पिपि धाध नाजाजे॰ तो मेरपुटर जाप
जपाजे॰ जरीम जिपक रुप पजा [redacted]
उजेजे तो पणुनतर॰ आदर॰ गीटर।
म॰ जेधा [redacted] धान नाशी गजेजे।
हेजे॰ तो जे रीजे छनोहुं जेशी तीजा।
बनी उपडीशीपा जे॰

एने दीदा हरीने द्वार सात पड़ाए ना पाछा
हरीने गरे आई• दशोंडीए ने ब्रामण करे
छे हरीए• आने मालम पडके न हीए•
तो धरमा मारगडा नीकडे ए दीदा टोरा
ना• जाधाए तो ब्रामण करे छे
हरीए तो• ताकुं नहीं तो मार गडो•
पछे जोने तो ब्रामण हरीए• ते मालम
मपडु रायां• दशोंडीए जंदाने
आगार नगुण हरीए• तो मोरना पाछा
लखने नाई नाजाए• अने ए
दीदा हरीने पार सात पडे•

तेदा हुन रात लगापुठी के० तोरतां इ जरुा
रान उरीरा छे० पजी जोके ना रजो जो हुजे ना
ठिकाणे० अने नाथ उठे तो० मोरना
पाछा टाण ने ना डी ना जाके० अने अेडो पा
रीने दार राख पड्या० तेवा दिन रात
लगत उठे णी ना जाके० तो राइ जे अारा
न उरे रहे छे० रतेन नामु जांशा अान तेडे पा
हरे अेग छे रहे ०००० ❀

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

શાવરો ઘ:॥ ઓરાશા બાઉ:॥
ઓરેરશ ચારેક:॥ ઉંક રોડ નનલુત:॥
બાકુ લખ પરાત પેશા મલ:॥
આશા ૭ લાખ જોગ રોગ:॥ ઈ લ બના
બંગત રે દરે પાઅ:॥ દરેના પાઅ
તાંઅ લાન નબા ફી આ રેગ:॥
તાંમ વાળ અ ાહા ી આ:॥ અડાત
રીઆ:॥ ત્રઈ આ:॥ ચોથા આ દુરે
પાલઅ:॥ દ રેન પાઅ તો અલાન
બાફીઆ રેગ:॥ બન રે તા લા:॥
બનર કમાડ:॥ બનરે બંદુ:॥ દશેદ
વારે:॥ નવ નાથ ચોરાશી શીધ કાશી
રાવ:॥ ઈ લા ભાફી ઈ લ બ લા:॥
નલખ શામ હોંજ અ:॥ અલા ફી આત્રે
:॥ ન બા પ્રાંહે મદ ફી આ રેગ:॥
રેગ ત વેચ:॥ શરે વેચ:॥ દરે વેચ
:॥ મદ વેચ:॥ બારે બાં રેગ:હાકે
રેગ:॥ ૭ શાકે રેગ:॥ શાકે ત શાકો
તરે:॥ મોંન લુત:॥ ખવાશ:॥
ખેત્રપાલ:॥ નરો ગ:॥ રૈબારે
આ:॥ રેત ગ તો આ લે રેવ:॥

मशां ख्यआ तपे तरेपाल:॥ ईडमीन

न ट:॥ मोअडी. मोमड:॥

मोरेशा मउहा:॥ मेला मोला:॥

लहेरे गहेरे:॥ धामखे पुमड:॥

नरे मोआंडी:॥ मोडांखल:॥

लमेलम:॥ वामे वामे:।

शा ह धरे मनी वां मा डे रे:॥

जरे ड तनजो मांहेमद डी शु पा

टोन डेरे:॥ हेड ला म लहोंधल

लाहो:॥ मांहेमद रे रेशु लला

हे:॥ शापुरे टा छ

२॥

[illegible]

परमानन्द लाशमलाहरनरहीम
शालतान शोहेद अहमद इजारे:
जन ३ पारेहाटद: मेत्र नजरावमल:
हलहा लहीया: नगनी हाजु जशाम:
मारेतासहारेश धराम: माहे महपारे:
ने तउठी हामरु देश नवे: शव मरेजहा
नजरा तारे तालवे: शवा मणहनेल
रातार ताम्राव: जांधु जांधु यारेवेद:
आतरेजांधु यारेवेद: पुरजजांधु यारे
वेद: हमेरा जांधु यारेवेद: पहमजां
धु यारेवेद: हशाहशाहा वेद लजांधु:
मेरीपारेवती जांधु: नल हीनग णजांधु:
धु: पल हीनग णी जांधु: आहाशाही
माहेनी जांधु: पातालहीहरम
हेल जां धु:

अमहती तणजांधु दशवनलजांधुः नत
हवारीजांधुः ओशा ठ ओगा ठीजांधुः दशा
शुरेतावटाजांधुः डीजाजांधुः ईडीजा
जांधुः डातराज डी धारेजांधुः जरेमा
डीजेडी जांधुः अदरेडी प्रेरीजांधुः
ईडा जा वंईरीवारे जांधु डीजावा
हीवारजांधुः डेल वाहीवारे जांधु
जोनोन वाहीवारे जांधुः शाई जदाव
रेजांधु उदतावारेजांधुः आना
तावारेजांधुः दशदशाडावारेजांधुः
अएमदावारेजांधुः मेएमदावारे
जांधुः दजताशाडा दरू रेजांधुः मा
रेतशाडा एावजांधुः आलतीशाडा
वाप जांधुः आजाजांधुः अएंजांजां
हईआ मशारेजांधुः चाडामशा
डजांधुः जोसतामशाजांधुः चालतामा
तेजांधुः दशतामशाजांधुः दरवरमशांडावा

જગજગ અનાથ બાંધુઃ ૬૦ ૭ આકાશ બાંધુઃ
પાતાલ બાંધુઃ રોઈપા બાંધુ પાતાલ બાંધુઃ વાગબ
ધુઃ લકડ શેરકા મુખ બાંધુ રોગ બાંધુઃ અકાશ
બાંધુ બેત્ર પાત્ર બાંધુઃ હૈમાંન બાંધુઃ ભેરવ બાંધુઃ
ડીઆ બાંધુઃ ડેરા બાંધુઃ રાડા બાંધુ રેટેલકા
બાંધુઃ મેતરે બાંધુઃ જત્ર બાંધુઃ લાઈ બાંધુઃ લાગા
બાંધુઃ વારે બાંધુ ગારે બાંધુઃ દાડકા બાંધુઃ શાઈ કાબાં
ધુઃ ભૂત બાંધુ પલીત બાંધુ પરજ બાંધુઃ બારેર શો બાંધુઃ
બતરડાકા બાંધુઃ બાવન વારે બાંધુઃ શાત વારેગ બાંધુઃ
નવ ઘરેહે બાંધુઃ અગમ બાંધુઃ અગાર પર બાંધુઃ નાઈ અબાંધુ
વઈલ બાંધુઃ શ ધારાતેન બંગરા બાંધુઃ હીરે બેઠા વાઈ
બાંધુઃ ચોકર બાંધુઃ કીવા બાંધુઃ નહીના બાલ
બાંધુ જળ પરા બાંધુ પલ પરા બાંધુઃ હુર પરી બાંધુઃ
નરે પરા બાંધુઃ લાલ પરા બાંધુઃ માલ પરા બાંધુઃ
રૂધ પરા બાંધુઃ રધ પરા બાંધુઃ અશમાંન પરા બાંધુઃ
એકલાખ એશી હજાર પારો પેગ મરેકા એઈ કાર બાં
ધુઃ હમે રાબધા છુટે: તો બાવા આદમ શફા
કી જગા દેઈ: શલ તાન શેહ મઈ મદ આએ
આઃ ઈલ બલા તોડ: ન બા માઈ મદ આ
આઃ ઈલ બલા તોડ: ૩॥
શપુરે તેગ છ

આદ શાસ્ત્ર રચાણા છે પુરખ
શા મવાર ત્યાં છ નાવારે નું પછમ
મંગલ ત્યાં. બુધ નું ઓતરે માં
રેવા ત્યાં. શાકરનું પછેમ
ગરૂ દખેણ રાહુ કેતુ રે છે : શાપુરે
ખછે ૐ શાપુર ખછે
જોગણી નો શાલો બલ આઓ છે
૧૩।।

૧	૯	પુરખ જોગણી :। ઉઠ બીઆ શવારે	:
૨	૧૦	ઉતર જોગણી ઓતરે તેની અશવારી	:
૩	૧૧	અગ્નાન જોગણી : વાઘની અશવારી	:
૪	૧૨	નારૈત જોગણી : શાપાનીની અશવારી	:
૫	૧૩	દખણ જોગણી : ઘોડાની અશવારી	:
૬	૧૪	પછમ જોગણી : ખરની અસવારી	;
૭	૧૫	વાવ જોગણી : કુતરાંની અશવારી	:
૮	૩૦	ઈશાન જોગણી હાથીની અશવારી	:
		શાપુર ખછે ૐ ૨૪	

मोटो राहाल लेख्य आ छे

फागण: चैत्र: वैशाख: दखण रेहे

टा: पछेम वहे: अगननी अशवारी: धा

ने ह: आशाड: श्रावण: पछम रोटा:

आत्रे वहे: मछनी अशवारी: २॥

भादरवो: अशु: कारतक: उतर रोटा:

पुरब वहे: शरपनी अशवारी: ३॥

मागशर: पोश: माह: पुरब रोटा:

दखण वहे: मानवनी अशवारी: ४॥

शबुर रेग दहे: ॐ १५

आठाइ रोआं लेखे आ छे:
पुरेज दशागडी:४॥ वाव खुरेगडी:४॥
दजे हे दशागडी:४ दशांन घुडेगडी:४॥
पछे दशा घडी:४॥ अगन घुडेगडी:४॥
आंतरे दजे रेगडी:४॥ नारांत घुडेगडी:४॥
दशाल अेक पधेगडीआरे लोग वे:२६ कु
अहदरोल आ छे: अज वाज आ को छे
: आवा. अे गी आरशे: रात नाल
दरो:१॥ आठम: पुनम: दाडानालदरो
:२॥ लदरो अवा रोआ ना: क्रांत
दशम: रात नाल दरो:२॥ शातम: चउ
दशदाडानालदरो:२॥ आशापुर जे छ
: छो इनो वाआरे छे: पुरेज छोजे:
मरे जे शाने हे:२॥ अगन छोइ: क्रश
वेहदे:२॥ दखाण छोडे घनडी हांरा
:३॥

नारे त छाई: मलावे पे आं हेट: ४॥
पछम छीई: जोहारे: ५॥ वावा छीई:
मलेल हारे: ६॥ आतरे छाई: हीजेप
नवंत: ७॥ ईशान छीई: धनमनता
: ८॥ आवश छीई: ईहीनांमी जेमा:
गरे जेही अनदईरे ऐरी: ९॥ आईश
छीई: जेन रे नाअ: तेई रोम हरेमा:
लात नाजाअ: १०॥ पतपई:
शहाअ शेखा: अेवानन नामा ई वे:
गरु गोरे अजती: शपुरे हेट छे:
१७॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

पीर नजुधन नी आसा अत दीठा छे
सुधारणा पीर सम्स ॥ पीर नजुधन जुपतो
छसम नीनालाजा दीनु पीहोली पा
पानु रूप धाये ॥ दीन पीहोर सम्स
तं पीर नजुधन जुपे तो आता हुता तम
जहीहार हर पानु रूप धाये ॥
ज पीर सम्स तं पीर नजुधन जुपे तो
नजी साहु जना हेलल सामेजुगा
नूरूप धाये ॥ पाइ लेखो ईनगा
ग्यार हाजेत ते पीर नजुधन तजु
पेतो छसमहोसे नहोसेनना हास
पीसालापानु रूप धाये ॥
सावनापजेते पीर नजुधन तजुपे
तो साहु पीर हुनगुरगु लाखाली
नेहर सत लीपानु रूप धाये ॥
रातपीहोरेलना पीर नजुधन ते

तेचादाम्ता वेइाने सोदालपाऽे तो
नजीसाइजनुमो लोपानुइकवाये
तेवाफ्रस्तनपाइंमरएग घोए/ने
पाघानुइकवाये ॥ लोमऽग सम
समरतमोहारनजुपतन· हरसेन
इरेतेया दाम्ता नेइ ने सोदालपाऽ
तातेनउइपलइरनसोहलोया
येतेयासाहजदहारयापतेछप
ने जेसतनसाजरइसे ॥

आ जी हार न जइद ला जारेनाहते जाइ

जेपापजतछोमघे मोरनजुपतन
हरसनहोलइशपे जेमछत लो
छनसइाजो ता हप सपेइमपेइपा
मलोवे ॥ जेमइरतलोएवसरउा
जेता देनजाऽमपेइपार लोइके

जेम इ रतलोधन सइ तोयं इमेडीन।
मजेइ पार लोधजे ॥ जेम इ रत
लोध नसइ तो परसजे इमजेइ पा
र लोधजे ॥ जेम इ रत लो धसइ
तो योमरसरे दे मजेइ पार कुदे तो ते
ने सा इज ने सत वर सा जइ से बइ
जेइ म इर कुडोजे तो मोर नकुदत
पामी ने पा लोधजेइ रे तो ते इ मइ
ने पाजे जोलजप पाजे जे मोरन
कुदत तो पानु सर दे पर मछ ॥
इ पत पार सो इरे दीन पीर इजीर
दीवन ॥ सत गोर पातर मोमा जेइ
रधमम सा इा नरमला तेम मइ
सा इा ॥ इइला जेले इमम इरस
लखा ॥ प्रत पर मइ सइ सइ

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] 30

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

94

[illegible]

[illegible]

realpatidar.com

26

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

realpatidar.com

રામ ગોપર ચંદનો [illegible] [illegible] [illegible]
કૉ [illegible] રામ મેળ વાળ ગા [illegible]

ભાગ્યાવા દરિયામાં એક [illegible] પગાર ભાગ્યમાં રાજ કુમાર =
તેને [illegible] કુપાળા [illegible] [illegible] [illegible] ન કીધું =
તેને ગાગા સાધુ સંગ [illegible] પુરૂષોના સેવા કરે =
તો [illegible] [illegible] [illegible] [illegible] એક રાજા [illegible] [illegible]
[illegible] રાજ કુંવરમાં [illegible] [illegible] રાજા [illegible]
ઈ કહેવા [illegible] કે [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
ગુ [illegible] [illegible] [illegible] મારા મને [illegible] પ્રેમ [illegible] કે
[illegible]





ડાબે :
સંશોધન સહાયક કાર્યકર
ગાલિના અબેયારોવા મોસ્કોની
એક શાળાના શિષ્યોને
સંગ્રહાલય બતાવે છે



જમણે :

